

ત્વરિત જાહેરાત માટે

સીટી ડાઉનટાઉન બ્રેમ્પટનમાં ધંધાઓ માટે કર્બસાઈડ પિકઅપને ટેકો આપે છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જુલાઈ 30, 2020) – આ અઠવાડિયે, સીટી ઓફ બ્રેમ્પટનને સ્થાનિક ધંધાઓ અને રહેવાસીઓને સહાયરૂપ થવા ડાઉનટાઉનમાં નવા કર્બસાઈડ પિકઅપ પાર્કિંગ ઝોન્સ રજૂ કર્યાં.

ધંધાઓએ COVID-19 નાં પ્રભાવો સામે સુમેળ સાધ્યો છે અને પોતાના ધંધા ઓનલાઈન કર્યાં છે ત્યારે, ગ્રાહકો અને સમુદાયના આરોગ્ય અને સુરક્ષાને સંરક્ષણ આપવામાં મદદ કરવા કર્બસાઈડ પિકઅપ અને વિતરણને પ્રોત્સાહન મળ્યું.

ડાઉનટાઉનમાં પાર્કિંગ માટે વધેલી માગને ધ્યાનમાં લઈને અને ડાઉનટાઉન બ્રેમ્પટન બિઝનેસ ઈમ્પ્રૂવમેન્ટ એસોસિએશન (BIA) સાથેની સલાહ-મસલતમાં, સીટીએ “લોડિંગ ઝોન્સ”ને ધંધાઓ, ગ્રાહકો અને રહેવાસીઓને સુરક્ષિત રાખવાના પ્રયત્નમાં કર્બસાઈડ પિકઅપ પાર્કિંગ તરીકે પણ ઉપયોગમાં લેવાની મંજૂરી આપી. જગરૂકતા વધારવામાં મદદ કરવા, કયા વિસ્તારોનો ઉપયોગ 15-મિનિટ કર્બસાઈડ પિકઅપ પાર્કિંગ જગ્યાઓ માટે કરી શકાય તે દર્શાવવા સાર્ઠન બોર્ડર્સ બેસાડવામાં આવ્યાં. આ સ્થળોમાં સામેલ છે:

- 46 ક્વીન સ્ટ્રીટ ઈસ્ટ
- 12 ક્વીન સ્ટ્રીટ ઈસ્ટ
- મેઈન સ્ટ્રીટ નોર્થ - ગાર્ડન સ્ક્વેર
- મેઈન સ્ટ્રીટ નોર્થ - વિવિયન લેન
- 24 મેઈન સ્ટ્રીટ સાઉથ
- 74 ક્વીન સ્ટ્રીટ વેસ્ટ

COVID-19 સામે પોતાની સમગ્ર પતિક્રિયામાં, સીટીએ સ્થાનિક ધંધાઓને પોતાની રિકવરીમાં સહાયરૂપ થવા અને તેઓ સુરક્ષિત રીતે કાર્ય કરી શકતા હોવાની ખાતરી કરાવવા મદદ કરવાના ઉપાયો રજૂ કર્યાં:

- મે 13 નાં રોજ, [બ્રેમ્પટન કાઉન્સિલે ઈકોનોમિક રિકવરી સ્ટ્રેટેજી](#) શહેર માટે સ્થાનિક અર્થતંત્ર ફરી શરૂ કરવા આગળ વધવા માટેના માળખા તરીકે મંજૂર કરી.
- મે 20 નાં રોજ, [સીટી ઓફ બ્રેમ્પટનને પોતાની “સપોર્ટ લોકલ” ઝુંબેશ](#) શરૂ કરી જેથી રહેવાસીઓને ખરીદી કરવા, બહાર ખાવા જવા, ગિક્ટ ખરીદવા અને સ્થાનિકોને સહાયરૂપ થઈ શકાય.
- મે 29 નાં રોજ, બ્રેમ્પટને કેનેડાના સૌ પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ પૈકી એક તરીકે [ShopHERE \(શોપ હીયર\) કાર્યક્રમ](#)માં પોતાની સહભાગિતાની ઘોષણા કરી.
- જૂન 24 નાં રોજ, [સીટીએ પોતાનો પેટિઓ \(ઉઘાડી જગ્યા\) બ્રેમ્પટન કાર્યક્રમ શરૂ કર્યો](#) જેનાથી શહેરની રેસ્ટોરન્ટ્સ અને બાર્સને પોતાના પેટિઓ વિસ્તારવાનું અને બહારના ભાગે વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાનું શક્ય બન્યું. પેટિઓ બ્રેમ્પટન કાર્યક્રમ મારફતે, વધારે રહેવાસીઓ ઉનાળુ હવામાનનો આનંદ માણવા, અને સ્થાનિક ધંધાઓને સહાયરૂપ થવા આઉટડોર જઈ શક્યા છે. આજની તારીખ સુધીમાં, 38 અરજીઓને પેટિઓ બ્રેમ્પટન કાર્યક્રમ મારફતે મંજૂરી મળી છે.

અવતરણો (ક્વોટ્સ):

“અમે સમગ્ર મહામારી દરમિયાન આપણાં સ્થાનિક ધંધાઓને સહાયરૂપ થવા અમારાથી શક્ય બધું કરી રહ્યાં છીએ, અને આ નવા કર્બસાઈડ પિકઅપ પાર્કિંગ ઝોન્સથી ગ્રાહકો માટે પોતાના મનપસંદ સ્થાનિક ધંધામાંથી સુરક્ષિત રીતે ખરીદી કરવી વધારે સરળ બનશે. ચાલો આપણે સૌ

સ્થાનિક ધંધાઓને સહાયરૂપ થવાનું ચાલુ રાખીએ અને આપણાં સમુદાય અને અર્થતંત્રને આ પડકારભર્યા સમયમાંથી રિકવર થવામાં મદદ કરીએ.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રમ્પટન

“અમારો આર્થિક સહાયતા ટાસ્ક ફોર્સ આપણાં સ્થાનિક ધંધાઓ સાથે ઘનિષ્ઠપણે કાર્યરત છે જેથી તેઓને COVID-19 નાં પ્રભાવોની શોધખોળ કરવામાં મદદ મળે, અને આપણે આ પ્રોવિન્સના રિઓપનીંગ અને રિકવરીના તબક્કા 3 માં પ્રવેશીએ છીએ ત્યારે અમે આપણાં ધંધાકીય સમુદાયને સહાયરૂપ થવાની રીતો શોધવાનું ચાલુ રાખીશું.”

પૉલ વિસેંટે (Paul Vicente), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5; કો-લીડ (સહ-આગેવાન), આર્થિક સહાયતા ટાસ્ક ફોર્સ; સીટી ઓફ બ્રમ્પટન

“કર્બસાઈડ પિકઅપ પાર્કિંગ ઝોન્સ અમે સમગ્ર શહેરમાં આપણાં સ્થાનિક ધંધાઓને સહાયરૂપ થવા લીધેલા પગલાઓનું બીજું એક ઉદાહરણ છે. આ ધંધાઓ આપણાં સમુદાયની કરોડરજત્તુ છે અને તેઓ આપણાં અર્થતંત્રનો અતૂટ ભાગ છે. હવે પહેલાં કરતા પાણ વધારે, આપણે COVID-19 નાં પ્રભાવોમાંથી આપણાં શહેરને રિકવર થવા સ્થાનિક ધંધાઓને સહાયરૂપ થઈએ તે મહત્વપૂર્ણ છે.”

- માઈકલ પાલેશી (Michael Palleschi), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 2 અને 6; કો-લીડ (સહ-આગેવાન), આર્થિક સહાયતા ટાસ્ક ફોર્સ; સીટી ઓફ બ્રમ્પટન

“કાઉન્સિલ અને સીટી કર્મચારીઓ COVID-19 નાં ચાલુ રહેલા પ્રભાવો સામે પ્રતિક્રિયા કરી રહ્યાં છે ત્યારે તેઓએ આપણાં સ્થાનિક ધંધાઓને સહાયરૂપ થવા નવીન અને સુરક્ષિત રીતો શોધી કાઢી છે. આપણાં સ્થાનિક ધંધાકીય સમુદાય અને હિતધારકો સાથે સતત પ્રવૃત્તમય રહીને, અમે બ્રમ્પટનની સંપૂર્ણ રિઓપનીંગ અને રિકવરીને સહાયરૂપ થવા નવા ઉકેલો પર કામ કરવાનું ચાલુ રાખીશું.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca